

મુદ્દા નં.૧૭ :-

માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સવલતોની વિગતો.

- (૧) કચેરી ગ્રંથાલય
- (૨) વર્તમાન પત્રો
- (૩) પ્રદર્શનો
- (૪) જાહેર ખબરના અન્ય સાધનો.

ગુજરાત રાજ્ય

ગુજરાત સાહિત્ય અકાદમી

(૧)

ઉદ્દેશ પત્ર

(મેમોરેન્ડમ ઓફ એસોસીએશન)

૧. આ સ્વાયત રજીસ્ટર્ડ સંસ્થાનું નામ ગુજરાત સાહિત્ય અકાદમી રહેશે.
૨. અકાદમીનું મુખ્ય મથક ગાંધીનગર રહેશે.

૩. અકાદમીના ઉદ્દેશો નીચે પ્રમાણે રહેશે :
 ૧. ગુજરાત પ્રદેશમાં બોલાતી ગુજરાતી ભાષા ઉપરાંત અન્ય ભાષાઓ જેવી કે બંગાળી, મરાઠી, પંજાબી, તમિળ, તેલુગુ ઇત્યાદિ ભારત સરકાર માન્ય ભાષાઓ તથા ગુજરાત પ્રદેશની ડાંગી, કચ્છી, વગેરે બોલીઓ અને તેના સાહિત્યના વિકાસ, સંશોધન અને ઉત્કર્ષ માટે કામગીરી કરવી.
 ૨. અકાદમીના ઉદ્દેશો જેવા સમાન ઉદ્દેશો માટે કાર્ય કરતી માન્ય સાહિત્ય-સંસ્થાઓ અને મંડળોને આર્થિક તેમજ અન્ય પ્રકારે સહકાર આપવો.

4. દિલ્હીની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી તેમજ ભારતનાં અન્ય રાજ્યોની પ્રાદેશિક ભાષા-સાહિત્ય માટેની અકાદમીઓ તથા ગુજરાત બહાર સંબંધિત ભાષા-સાહિત્ય અંગે પ્રવૃત્તિ કરતી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સાહિત્ય અંગે આદાન-પ્રદાન કરવું તેમજ એ માટે જરૂરી આર્થિક પ્રબંધ કરવો.
5. અકાદમીની પ્રવૃત્તિઓ માટે દાન અને અનુદાન ધ્વારા ભંડોળ એકત્ર કરવું.
6. ગુજરાતમાં બોલાતી સંબંધિત ભાષાના સામયિકો અને ગ્રંથો પ્રકાશિત કરવા.
7. ગુજરાત રાજ્યની સંબંધિત ભાષા-સાહિત્ય ક્ષેત્રની સંસ્થાઓને માન્યતા આપવી અને તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે આર્થિક અનુદાન ધ્વારા સહાય કરવી. ગુજરાત રાજ્યના જુદા જુદા પ્રદેશોનાં વિશિષ્ટ બોલીગત સાહિત્યના તેમજ લોકસાહિત્યના વિવિધ પ્રકારો અને સ્વરૂપોની સમીક્ષા કરવી તથા તેવા સાહિત્યને જાળવી રાખવા યોગ્ય પ્રબંધ કરવો.
8. સંબંધિત ભાષા સાહિત્ય માટે સાહિત્યિક ગોષ્ઠિઓ, પરિસંવાદો, પુસ્તક પ્રદર્શનો, તાલીમ શિબિરો, ઉત્સવો, મેળાઓ, પ્રવાસો, ઇત્યાદિનું આયોજન કરવું અને એ પ્રકારની કામગીરી કરતી અન્ય સાહિત્ય સંસ્થાઓને આર્થિક સહાય કરવી.
9. ગુજરાતના સંબંધિત ભાષા સાહિત્ય ના સિદ્ધિવંત લેખકોને અને તેમની કૃતિઓને પુરસ્કારથી સન્માનવા પ્રબંધ કરવો.
10. સંબંધિત ભાષાના ક્ષેત્રે નામાંકિત એવા ગુજરાતના સર્જકો અને વિદ્વાનોને ફેલોશીપ પ્રદાન કરવી.
11. ગુજરાતના સંબંધિત ભાષા સાહિત્ય ક્ષેત્રે ગુણવત્તાલક્ષી સેવા બજાવી હોય એવા ગુજરાતમાં વસતા વયોવૃદ્ધ અને સહાયપાત્ર લેખકોને યોગ્ય આર્થિક સહાય કરવી.
12. રાજ્યની પંચવર્ષીય યોજનાઓ હેઠળ સંબંધિત ભાષા સાહિત્યના વિકાસ અન્વયે જે પ્રાયોજનાઓ રાજ્ય સરકારે મંજૂર કરી હોય અને અકાદમીના ઉદ્દેશો અને કાર્યપ્રદેશો સાથે જે સંબંધ ધરાવતી હોય તેવી પ્રાયોજનાઓનો અમલ કરવો.
13. ગુજરાત પ્રદેશનાં સંબંધિત ભાષા સાહિત્યને ઉપકારક થાય તેવા સંશોધન કેન્દ્રો, સ્વાધ્યાપીઠો ઇત્યાદી સ્થાપવા અને વિકસાવવાં તેમજ આવા માન્ય કેન્દ્રોને આર્થિક સહાય કરવી.
14. ગુજરાતની સંસ્કૃતિના ચેતનાસ્ત્રોતને વેગ મળે તેવાં સંશોધન, પ્રકાશન અને અન્ય સહાયક કાર્યો હાથ ધરવાં.

ગુજરાતના સંબંધિત ભાષા સાહિત્યનાં વિકાસ માટે જરૂરી હોય અને ઉપરનાં ઉદ્દેશોમાં જેની સ્પષ્ટતા કરવામાં આવી ન હોય તેવી તમામ પ્રવૃત્તિઓ કરવી.